

**GUJARAT TECHNOLOGICAL UNIVERSITY**  
**DIPLOMA ENGINEERING – SEMESTER – VI• EXAMINATION – SUMMER 2016**

**Subject Code: 3360703****Date: 11/05/2016****Subject Name: Network Management and Administration****Time: 10:30 AM to 01:00 PM****Total Marks: 70****Instructions:**

1. Attempt all questions.
2. Make Suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. Use of programmable & Communication aids are strictly prohibited.
5. Use of only simple calculator is permitted in Mathematics.
6. English version is authentic.

**Q.1** Answer any seven out of ten. દશમાંથી કોઈપણ સાતના જવાબ આપો. 14

1. What is network administration?
૧. નેટવર્ક એડમિનિસ્ટ્રેશન એટલે શું?
2. Write the full form of PSTN, DHCP, VPN and ISDN.
૨. PSTN, DHCP, VPN અને ISDN ના આખા નામ લખો.
3. Explain DSL.
૩. DSL વણેવો.
4. Explain CATV.
૪. CATV વણેવો.
5. Explain SSL.
૫. SSL વણેવો.
6. Explain ipconfig and ping command.
૬. Ipconfig અને ping કમાંડ વણેવો.
7. Explain Built in user account.
૭. બ્યુલ્ટ ઇન યુસર એકાઉન્ટ વણેવો.
8. What is server? List the different type of server.
૮. સરવર એટલે શું? જુદા જુદા સરવર ના પ્રકાર લખો.
9. Explain Firewall.
૯. ફાયરવોલ વણેવો.
10. What is mapping drive?
૧૦. મેપિંગ ડ્રાઇવ એટલે શું?

**Q.2** (a) Explain Novel Directory Service. 03  
**પ્રશ્ન. ૨** (અ) નોવેલ ડિરેક્ટરી સરવીસ વણેવો. 03

OR

- (a) Short note on LDAP. 03
- (અ) LDAP પર રૂક નોંધ લખો. 03
- (b) Write the need of remote network access. 03

(બ્ય)	રિમોટ નેટવર્ક એક્સેસ ની જરૂરયાત લખો.	03
OR		
(બ)	What is VPN? Explain with their types.	03
(બ્ય)	VPN એટલે શું? તેના પ્રકાર વણેવો.	03
(ચ)	Explain PSTN and ISDN.	04
(ઝ)	PSTN અને ISDN વણેવો.	08
OR		
(ચ)	List and explain VPN protocol.	04
(ઝ)	VPN પ્રોટોકોલ ની યાદી બનાવો અને વણેવો.	08
(દ)	Explain Active director services.	04
(ઝ)	એક્ટિવ ડિરેક્ટરી સરવીસ વણેવો.	08
OR		
(દ)	Short note on X500 Directory Access Protocol.	04
(ઝ)	X500 ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ પર ટ્રક નોંધ લખો.	08
<b>Q.3</b>	(ા) Write the advantages and disadvantages of DHCP.	03
<b>પ્રશ્ન. 3</b>	(બ્ય) DHCP ના ફાયદા અને ગેરફાયદા લખો.	03
OR		
(ા)	Short note on RARP.	03
(બ્ય)	RARP પર ટ્રક નોંધ લખો.	03
(બ)	Explain various IP address schemes in DHCP.	03
(બ્ય)	DHCP ના IP એડરેસ ની જરૂરી જરૂરી સ્કીમ વણેવો.	03
OR		
(બ)	Explain DNS registration process.	03
(બ્ય)	DNS રજિસ્ટ્રેશન પ્રક્રિયા વણેવો.	03
(ચ)	Explain Web server and Printer server.	04
(ઝ)	વેબ સરવર અને પ્રિંટર સરવર વણેવો.	08
OR		
(ચ)	Explain File server.	04
(ઝ)	ફાઇલ સરવર વણેવો.	08
(દ)	Write the step for install window server.	04
(ઝ)	વિનંદોવ સરવર દાખલ કરવાના પગથિયા લખો.	08
OR		
(દ)	List and explain various network security in short.	04
(ઝ)	જરૂરી જરૂરી નેટવર્ક સિક્યુરિટી ટ્રક માં લખો અને વણેવો.	08
<b>Q.4</b>	(ા) Short note on recourse sharing.	03
<b>પ્રશ્ન. 4</b>	(બ્ય) રિસોર્સ સેરિંગ પર ટ્રક નોંધ લખો.	03
OR		
(ા)	Explain BOOTP.	03
(બ્ય)	BOOTP વણેવો.	03
(બ)	Explain user accounts with their types.	04
(બ્ય)	યુસર એકાઉન્ટ તેના પ્રકર સાથે વણેવો.	08
OR		
(બ)	Explain Group account.	04

(b)	ગુપ એકાઉન્ટ વણોવો.	08
(c)	List and explain the troubleshooting tools in networking.	07
(d)	નેટવરકિંગ ના ટ્રબ્લસ્યુટિંગ ટુલ ની યાદી બનાવો અને વણોવો.	09
<b>Q.5</b>	<b>(a) Short note on DHCP architecture.</b>	<b>07</b>
<b>પ્રશ્ન. ૫</b>	<b>(અ) DHCP આરકિટેક્ચર પર દ્વારા નોંધ લખો.</b>	<b>09</b>
	(b) Explain DNS with their hierarchy.	07
	(બ) DNS તેના વર્ગીકરણ સાથે વણોવો.	09
	(c) List and explain different types of File and Directory permission.	03
	(દ) જુદા જુદા પ્રકાર ની ફાઇલ અને ડિરેક્ટરી પરમિસન ની યાદી બનાવો અને વણોવો.	03
	(d) What is network printer? Write the important of them.	03
	(સ) નેટવર્ક પ્રિંટર એટલે શું? તેનું મહત્વ લખો.	03

\*\*\*\*\*